



ગર્ભાવસ્થા, પ્રજનનક્ષમતા અને COVID-19 માટેની રસીઓ



જો તમે ગર્ભવતી હોવ, ગર્ભાવતી આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો COVID-19 માટેની રસી લો.

- ગર્ભાવસ્થા દરમિયાન રસીકરણ પ્રતિદ્રવ્યો (રક્ષણ) બનાવે છે જે તમને અને તમારા બાળકને સ્વસ્થ અને સલામત રાખવામાં મદદ કરી શકે છે.
- COVID-19થી અસરગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ થયેલા લગભગ 90% બાળકોની માતાઓએ ગર્ભાવસ્થા દરમિયાન COVID-19 માટેની રસી લીધી ન હતી.¹



COVID-19 ગર્ભવતી મહિલાઓ માટે વધુ ખતરનાક છે.

- ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થાને અસર કરતી જટિલતાઓનું જોખમ વધારે હોય છે, જેમ કે અધૂરા મહિને પ્રસૂતિ (37 અઠવાડિયા પહેલાં થતી પ્રસૂતિ) અને કસુવાવડ (ગર્ભાવસ્થા ગુમાવવી).



ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સમયે COVID-19 માટેની રસી લો.

- રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) અને અન્ય તબીબી સંસ્થાઓ ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સમયે રસીકરણ કરાવવાની ભલામણ કરે છે.
- ગર્ભવતી મહિલાઓ COVID-19 રસી અને ફ્લૂની રસી એક જ સમયે લઈ શકે છે.



COVID-19 માટેની રસીઓ DNAને અસર કરતી નથી અથવા ગર્ભવતી થવામાં કે પ્રજનનક્ષમતામાં સમસ્યા ઊભી કરતી નથી.

- COVID-19 માટેની રસીઓ આપણા DNAને અસર કરતી નથી કે તેમાં ભળતી નથી.
- ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહેલી મહિલાઓ માટે પણ તે સલામત છે.



COVID-19 રસીઓ શોધવા અને વધુ માહિતી માટે:

- nj.gov/health/vaccines/covid-19 ની મુલાકાત લો અથવા QR કોડ સ્કેન કરો.
- vaccines.govની મુલાકાત લો.
- CDC માહિતી માટેની લાઇનને 1-800-232-0233 પર ફોન કરો.
- આના પર મુલાકાત લો: cdc.gov/covid/vaccines/pregnant-or-breastfeeding.html.

